



ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

“રાજીવ ગાંધી ભવન” સંસ્કાર કેન્દ્ર માર્ગ, વી.એસ. હોસ્પિટલ પાસે, એલીસબ્રીજ, અમદાવાદ – ૩૮૦૦૦૬

ફોન : ૦૭૯-૨૬૫૭૮૨૧૨-૨૧૩, ૨૬૫૭૮૧૬૧, ૨૬૫૭૮૩૧૧ ફેક્સ : ૦૭૯-૨૬૫૭૮૫૮૯

Web : www.incgujarat.com

E-mail : gpcc1234@gmail.com

અખબારી યાદી


તા. ૧૩-૧૦-૨૦૨૫

- સ્પીડ અપ ચેક સેટલમેન્ટ પ્રોસેસની મોટી મોટી જાહેરાતો વચ્ચે તહેવાર સમયે કરોડો રૂપિયાના ચેક ક્લિયરન્સ અટવાયા, લાખો ગ્રાહકો થયા હેરાન-પરેશાન.
- બેંકના અવ્યવસ્થા તંત્રના ભોગ બન્યા લાખો ગ્રાહકો: ગ્રાહકોને ફટકારાઈ પેનલ્ટી: પાડાના વાંકે પખાલીને ડામ.
- રાષ્ટ્રીય બેન્કોએ પાંચ વર્ષમાં ગ્રાહકો પાસેથી જુદા જુદા સર્વિસ ચાર્જ પેટે ૯૦૦૦ કરોડ જેટલી માતબર રકમ વસૂલી:ખાનગી બેંકોએ દસ વર્ષમાં ગ્રાહકો પાસેથી ૩૫,૦૦૦ કરોડ જેટલી અધધ રકમ વસૂલી.

કેન્દ્રની મોટી સરકારના વધુ એક વખત અણધડ, અવિચારી પગલાને કારણે લાખો ગ્રાહકોને દિવાળીનાં તહેવારમાં ઊભી થયેલી ભારે હેરાનગતિ અંગે ભાજપ સરકારની ખોટી નિતિ જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું કે, સરકારની નિષ્ફળ નીતિઓએ બેંકિંગ વ્યવસ્થાને અરાજકતા અને આર્થિક કટોકટી તરફ ધકેલી દીધી છે. સ્પીડી ચેક ક્લિયરન્સની જાહેરાત પણ જરૂરી વ્યવસ્થાના અભાવ, બેંકીંગ કર્મચારીઓને પૂરતી તાલીમનો અભાવને લીધે દિવાળી તહેવારના સમયમાં ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચેક જમા કરાવ્યા બાદ રૂપિયા ખાતામાંથી ઉપડી જાય છે, પરંતુ સામેના ખાતામાં જમા થતા નથી. જરૂરી મેસેજ ફોરવર્ડ થાય છે. પહેલાં ૪૮ કલાકમાં રૂપિયા જમા થઈ જતા હતા, પરંતુ હવે ૭૨ કલાકમાં પણ નાણાં જમા થઈ રહ્યા નથી. આ ઉપરાંત, બેંક સ્ટાફને નવી સિસ્ટમની તાલીમ આપ્યા વિના જ તેનો અમલ કરવામાં આવ્યો, જેના કારણે ગ્રાહકોની હેરાનગતિ વધી છે. બેંકોના ગ્રાહકોને પડી રહેલી ભારે મુશ્કેલી છતાં બેંકના કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા નથી. જેના કારણે જે તે બેન્કમાં કર્મચારીઓ - મેનેજર સાથે સંઘર્ષની ઘટનાઓ બની રહી છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, નાણાં મંત્રાલયના અપૂરતા આયોજન અને અમલીકરણમાં મોટા પાયે ખામીના લીધે દેશના કરોડો નાગરિકો આર્થિક અફસા તડફીનો ભોગ બની રહ્યાં હોવાનો આરોપ મુકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, નોટબંધીનો અવિચારી નિર્ણય, ત્યારબાદ જી.એસ.ટી.ની અનેક વિસંગતતા, ખામીઓ, ગરબડ અને ગોટાળાને લીધે દેશમાં નાના-ધંધા રોજગાર પડી ભાગ્યા છે. દેશમાં સતત અસમાનતા વધી રહી છે જેને લીધે નાણાંકીય સંસ્થાઓ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સતત કેન્દ્રની મોટી સરકારે રિઝર્વ બેંકના

નીતિ-નિયમોને નેવે મૂક્યા છે. બેંકના કરોડો ગ્રાહકો, નાના વેપારીઓને અપૂરતા બેલેન્સ, સર્વિસ ચાર્જ અને દંડના નામે લૂંટવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં ૯૦૦૦ કરોડ રૂપિયા અને ખાનગી બેંકોએ ૧૦ વર્ષમાં ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની માતબર રકમ જુદા જુદા ચાર્જિસના નામે વસૂલી છે. ૨૧૦૦૦ કરોડ મીનીમમ બેલેન્સ, ૮૦૦૦ કરોડ વધારાના એટીએમ ટ્રાન્ઝેક્શનનાં નામે, ૬૦૦૦ કરોડ એસએમએસ સર્વિસના નામે બેંકો દ્વારા ગ્રાહકો પાસેથી ઉઘરવામાં આવ્યા. બીજીબાજુ કેન્દ્રની ભાજપ સરકારે છેલ્લા દશ વર્ષમાં ૧૬ લાખ કરોડ રૂપિયા મળતિયા ઉદ્યોગપતિઓનાં માફ કર્યા. બીજીબાજુ નાના વેપારીઓ પર જુલમ થઈ રહ્યો છે. રોકડ વ્યવહારમાં નિષ્ફળતા અને તહેવારોના સમયમાં લોકોની મુશ્કેલીઓએ આર્થિક તંત્રની નિષ્ફળતાને ઉજાગર કરી છે. કોંગ્રેસે પક્ષ માંગ કરે છે કે, સરકારે નાણાંકીય અવ્યવસ્થા રોકવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને લોકોની મુશ્કેલીઓ માટે જવાબદારી સ્વીકારવી જોઈએ.



ડૉ. મનિષ એમ. દોશી

મીડીયા કન્વીનર અને પ્રવક્તા